ધોળકાના સતપંથી સંઘનો ઠરાવ

આજ રોજ સંવત ૧૯૮૨ ના માહા સુદી ૧૧ ને તા. ૨૪–૧–૨૬ ને વીવારના રોજ ધોળકાના કાછીઆની નાત મળી ઠરાવ કરે છે કે પીરાણાના કાકા રામજી લક્ષ્મણે સંવત ૧૯૮૨ના પોસ સુદી ૨ વાર ગુરૂ તા. ૧૭–૧૨–૨૫ ના રોજ સૈયદ પુંજામીયા હુસેનમીયા પીરાણાવાળા વીગેરેને કેટલાક હકો બાબત દસ્તાવેજ લખી આપી તા. ૭–૧–૨૬ ના રોજ રૂ ૧૫) ના સ્ટાંમ્પ ઉપર લખી આપી રજીસ્ટાર કરી આપ્યો છે તે દસ્તાવેજથી આપણી નાતના માણસોના દીલ દુખાવ્યા છે તથા કેટલાક હકો નસ્ટ થયા છે તેથી આ દસ્તાવેજ સદરહુ કાકા તરફથી અગર બીજા સંઘો તરફથી રદ થાય નહી ત્યાં સુધી ધોળકાની કાછીઆની નાતવાળાએ પીરાણા આદીકના સૈયદો કે સાધુનું સનમાન કરવું નહી. તેમજ તેમને આશ્રય આપવો નહિ તેમજ જમાડવું પણ નહી અને ધરમ આદીકના પૈસા કે દક્ષણા વિગેરે કાંઈ પણ આપવું નહી. દર સાલ ઉઘરાવવામાં આવે છે તે રકમ ઉઘરાવવી અને નાત કહે તે જગ્યાએ તે રકમનો પીરાણા ગામ સીવાયના ધરમાદામાં ઉપયોગ કરવો આ ઠરાવમાં સુધારો વધારો કરવાનો અધિકાર દસ્તાવેજ રદ થયા સીવાય કોઇને નથી.

મુખી. દાળજી હરગોવન. સહી દા. પોતે

તા. ૨૫–૧–૨૬

શાન્તી સાગર પ્રી. પ્રેસ–અમદાવાદ.

ધોળકાના સતપંથી સંઘનો ઠરાવ

આજ રોજ સંવત ૧૯૮૨ ના માહા સુદી ૧૧ ને તા. ૨૪–૧–૨૬ ને રવીવારના રોજ ધોળકાના કાછીઆની નાત મળી ઠરાવ કરે છે કે પીરાણાના કાકા રામજી લક્ષ્મણે સંવત ૧૯૮૨ના પોસ સુદી ૨ વાર ગુરૂ તા. ૧૭–૧૨–૨૫ ના રોજ સૈયદ પુંજામીયા હુસેનમીયા પીરાણાવાળા વીગેરેને કેટલાક હકો બાબત દસ્તાવેજ લખી આપી તા. ૭–૧–૨૬ ના રોજ રૂ ૧૫) ના સ્ટાંમ્પ ઉપર લખી આપી રજીસ્ટ્રાર કરી આપ્યો છે તે દસ્તાવેજથી આપણી નાતના માણસોના દીલ દુખાવ્યા છે તથા કેટલાક હકો નસ્ટ થયા છે તેથી આ દસ્તાવેજ સદરહુ કાકા તરફથી અગર બીજા સંઘો તરફથી રદ થાય નહી ત્યાં સુધી ધોળકાની કાછીઆની નાતવાળાએ પીરાણા આદીકના સૈયદો કે સાધુનું સનમાન કરવું નહી. તેમજ તેમને આશ્રય આપવો નહિ તેમજ જમાડવું પણ નહી અને ધરમ આદીકના પૈસા કે દક્ષણા વિગેરે કાંઈ પણ આપવું નહી. દર સાલ ઉઘરાવવામાં આવે છે તે રકમ ઉઘરાવવી અને નાત કહે તે જગ્યાએ તે રકમનો પીરાણા ગામ સીવાયના ધરમાદામાં ઉપયોગ કરવો આ ઠરાવમાં સુધારો વધારો કરવાનો અધિકાર દસ્તાવેજ રદ થયા સીવાય કોઇને નથી.

મુખી. દાળજી હરગોવન. સહી દા. પોતે

તા. ૨૫–૧–૨૬

શાન્તી સાગર પ્રી. પ્રેસ–અમદાવાદ.